



જાહેરાત

એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ માહિતી ૨૦૨૨-૨૩

(સરકારી, આશ્રમ શાળા, ગ્રાન્ટ ઇન એડ, સરકાર માન્ય, સી.બી.એસ.ઇ માન્ય, NIOS OBE Program -લેવલ B નું પ્રમાણપત્ર અથવા આર.ટી.ઇ. એક્ટ ૨૦૦૯ ના ચેપ્ટર - ૨ મુજબની- શાળાઓના પાંચમાં ધોરણના આદિજાતિના બાળકો માટે)

આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો કાર્યરત છે. સદર શાળાઓ ધોરણ-૬ થી ધોરણ-૧૨ સુધીની છે. શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, રમતગમત, ચિત્રકલા, શિક્ષણ, લાયબ્રેરી વિગેરેની સુવિધા છે. એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલોમાં ધોરણ-૬ માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉત્તમકક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની શાળામાં પ્રવેશ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટપુલ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેલેન્ટપુલ યોજનાનો લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે. (ટેલેન્ટપુલ યોજનાનો લાભ લેવા માટે પ્રવેશ સમયે સરકારશ્રીના આવક મર્યાદા અંગેના પ્રવર્તમાન નિયમો ધ્યાને લેવામાં આવશે.)

પાત્રતાનું ધોરણ :-

- વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ અનુસૂચિત જનજાતિ (ST) હોવા જોઈએ.
- પ્રવેશ સમયે વિદ્યાર્થીઓની ઉંમર ૧૦ થી ૧૩ વર્ષની હોવી જોઈએ. (ઓછામાં ઓછી ૧૦ વર્ષ અને વધુમાં વધુ ૧૩ વર્ષ).
- વિદ્યાર્થી/વિદ્યાર્થીની હાલ સરકારી શાળા/આશ્રમશાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન એડ શાળાઓ, સરકાર માન્ય (શિક્ષણ વિભાગની યાદી મુજબ) અને સી.બી.એસ.ઇ. માન્ય, NIOS OBE Program -લેવલ B નું પ્રમાણપત્ર અથવા આર.ટી.ઇ. એક્ટ ૨૦૦૯ ના ચેપ્ટર - ૨ મુજબ - શાળાઓમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતા હોવા જોઈએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ-૫ પાસ કરેલ હોવું જોઈએ.
- આદિજાતિ વિસ્તારના આદિમ જુથના બાળકો અને હળપતી બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.
- વિમુક્ત/વિચરતી/અર્ધ વિચરતી જાતિના બાળકો, વિદ્યાર્થી જેના માતા પિતા ડાબેરી ઉગ્રવાદ/બળવો/કોવીડ ના કારણોસર મૃત્યુ પામેલ હોય, વિધવા માતાના બાળકો, દિવ્યાંગ માતા-પિતાના બાળકો, અનાથ (માતા-પિતા બન્ને હયાત ન હોય તેવા) વિદ્યાર્થીઓ માટે ૧૦% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે. દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના ૩% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે. (પ્રવેશ સમયે લાગુ પડતા જરૂરી પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.)

પ્રવેશ અરજીપત્ર લેવાના/મેળવવાના સ્થળો :

* સંબંધિત ગામની પ્રાથમિક શાળા	* તમામ એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો
* તમામ ગ્રામ પંચાયત	* તમામ આદર્શ નિવાસી શાળાઓ/આશ્રમ શાળાઓ
* તમામ જી.એલ.આર.એસ. / મોડેલ સ્કૂલો	* પ્રાયોજના વહીવટદારશ્રી અને મદદનિશ કમિશ્નરશ્રીની કચેરીઓ
* સરકારી પ્રાથમિક શાળાઓ	* તમામ પરીક્ષા કેન્દ્રો તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી

પ્રવેશ અરજીપત્ર જમાં કરાવવાના સ્થળો :

- અરજીપત્ર ભરીને જે પરીક્ષાકેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવાનું રહેશે. અને તે જ સ્થળેથી પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર ઇસ્યુ કરવામાં આવશે. અથવા જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્ર પર ટપાલથી અરજીપત્ર મોકલી શકાશે અને તે જ પરીક્ષા કેન્દ્ર પરથી ટપાલથી પ્રવેશપત્ર મોકલવામાં આવશે. આ સિવાય અન્ય જગ્યાએ અરજીપત્ર મોકલવામાં આવશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.
- પરીક્ષા દરમિયાન પાત્રતા ધરાવતા હોવાના કોઈ દસ્તાવેજી પુરાવાઓનો આગ્રહ રાખવામાં આવતો નથી. જો ઉમેદવારો પ્રવેશ માટે કસોટીના અંતે લાયક ઠરશે તો પ્રવેશ સમયે આ અંગેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. જે ઉમેદવાર મેરીટમાં આવશે તેમને એકલવ્ય શાળાની પસંદગી માટે કાઉલન્સેલીંગ માટે બોલાવવામાં આવશે તે ઉમેદવારે સંબંધિત દસ્તાવેજી પુરાવા તે સમયે રજૂ કરવાના રહેશે. જેથી ઉમેદવારને પોતે ઠરાવેલ પાત્રતા ધરાવે છે તેની ખરાઈ કરીને જ અરજી કરવા જણાવવામાં આવે છે. પ્રવેશ સમયે ઉમેદવાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોવા છતાં જો પાત્રતા ધરાવતા નહીં હોય તો કોઈ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

પરીક્ષા પધ્ધતિ :

- પરીક્ષા તા.૦૧/૦૫/૨૦૨૨ ને રવિવાર ના રોજ યોજવામાં આવશે, અને વિદ્યાર્થીઓએ સવારે ૧૦:૩૦ કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે. પરિક્ષાનો સમય સવારના ૧૧.૩૦ થી બપોરના ૧.૩૦ કલાક સુધીનો રહેશે પ્રશ્નપત્રમાં ભાષા કૌષલ્ય ક્ષમતા (અંગ્રેજી, ગુજરાતી, હિન્દી), અંકગણિત, બુધ્ધિમત્તાને લગતા વિષયોમાંથી વૈકલ્પિક પ્રશ્નો પુછવામાં આવશે પ્રશ્ન પત્ર લખવા માટેનો કુલ સમય ૨:૦૦ કલાક નો રહેશે.
- પરીક્ષા ઓ.એમ.આર. (OMR) પધ્ધતિથી લેવામાં આવશે.

અગત્યની તારીખો :

- * અરજીપત્ર મેળવવાની તારીખ ૧૫ માર્ચ ૨૦૨૨ થી
- * અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ : ૦૪-એપ્રિલ-૨૦૨૨ (સાંજે ૬.૦૦ વાગ્યા સુધી)
- * પરીક્ષાની તારીખ ૦૧-મે -૨૦૨૨ (રવિવાર)
- * પરિણામ જાહેર કરવાની તારીખ : મે ૨૦૨૨ (બીજું અઠવાડિયું)

અરજીપત્ર ભરવાની બાબતમાં જો કોઈ વિદ્યાર્થીઓને મૂશ્કેલી હોય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો.

- વિના મૂલ્ય હેલ્પ લાઇન નંબર ૧૮૦૦૨૩૩૭૯૨૮
- અમારી વેબસાઇટ www.eklavya-education.gujarat.gov.in
- સંબંધિત જિલ્લા પ્રાયોજના કચેરી અને નજીકની ઈ.એમ.આર.એસ./જી.એલ.આર.એસ./મોડેલ શાળા

સહિ/-

સ્થળ : ગાંધીનગર , તારીખ/૦૩/૨૦૨૨

કાર્યપાલક નિયામક, જી.એસ.ટી.ઈ.એસ.